https://archive.org/details/bk405/page/n0/mode/1up

2011-04-01 -Divya Bhaskar -Online -Pirana Java Sangh Ravana (405)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

divyabhaskar.com

Home | Gujarat | India | World | Cricket | Entertainment | Lifestyle | Ajab-Gajab | Religion | Business | Editorial

Full Library on https://realpatidar.com/library

DakshinGujarat MadhyaGujarat Saurashtra UttarGujarat Kutchh Ahmedabad Vadodara Surat Rajkot DiuDaman

Home >> Madhya Gujarat >> Vadodara District >> sankheda

સાધલીનો સંઘ પીરાણા જવા રવાના

Source: ભાસ્કર ન્યૂઝ . સાધલ� | Last Updated 4:03 AM [IST](01/04/2011)

Article Like Share 0 tweet Share

Advertisement

શિનોર, ડભોઇ તાલુકાના બારગામ પાટીદાર સમાજના સતપંથી ભકતો પરંપરાગત અમૃત મહોત્સવનો લહવો લેવા પગપાળા યાત્રા સંઘ સાથે વહેલી સવારે નીકળી ગયા છે. ગ્રામજનો દ્વારા તેઓને ભાવભીની વિદાય આપી હતી.

શિનોરના અવાખલ, માંજરોલ, કુકસ, ભેખડા-સાંધા, પુનિયાદ, માલપુર સહિત ડભોઇ તાલુકાના પિસાઇ ગામના સતપંથી ભાઇ-બહેનો તા.૩૧મી માર્ચના ગ્રામજનોની વિદાય સાથે દર વર્ષની જેમ શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા મુકામે યોજાયેલાઅમૃત મહોત્સવનો લહાવો લેવા પગપાળા નીકળ્યા છે. જેઓ તા.૫મી એપ્રીલના પીરાણા પહોંચશે. જયાં આ તમામ પદયાત્રીઓનું ભવ્ય સામૈયું કરાશે.

પીરાણા મુકામે સવારના ૪ વાગે વારીયક્ષ ૭ વાગે સંઘોનું સામૈયુ, ૯ થી ૧૧:૩૦ સત્સંગ તથા જગદ્ગુરૂ સત પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ અને અન્ય સંતો-મહંતો આશીર્વાદ આપી ધર્મસભા સંબોધશે. આ પ્રસંગે ગુજરાત, સુરત, અમદાવાદ, કચ્છ, કાનમ પ્રદેશ સહિત મહારાષ્ટ્રથી ૧ લાખ ઉપરાંત સત્યથી ભાઇ-બહેનો પગપાળા આવે છે. તા.૫મી એપ્રીલના આ વિશાળ સંઘો માટે બ્રહ્મભોજનના દાતા તરીકે શિનોર તાલુકાના કુકસના સ્વ. નાથાભાઇ ગુલાબભાઇ પટેલનું પરિવાર તથા જામરંલા કથા, ગુજરવા કંપાના ડાહ્યાભાઇ પટેલ, રમણભાઇ પટેલ તથા જયંતીભાઇ પટેલ છે. કાનમ પ્રદેશના અવાખલના ટ્રસ્ટી સુરેશભાઇ એમ. પટેલે શ્રધ્ધાળુઓને લાભ લેવા અપીલ કરાઇ છે.

Previous Story
મોટી આદરજમાં પીવાના પાણીની પાઈપલાઈન બદલાશે

Next Story
મહાનગર પાલિકાની ચૂંટણીમાં પોલીસનું એનઓસી લેવા ભીડ

realpatidar.com

https://archive.org/details/bk405/page/n1/mode/1up

Real Patidar
Unravel Truth

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk405/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.18 18:03:23 +05'30'

realpatidar.com

divyabhaskar.com

Source: http://www.divyabhaskar.co.in!article/MGUJ-1295698-1981555.html
Download Date: 27-May-2011

સાધલીનો સંઘ પીરાણા જવા રવાના

Source: ભાસ્કર ન્યૂઝ . સાધલ� | Last Updated 4:03 AM [IST](01/04/2011)

Article Like Share 0 tweet Share

Advertisement

શિનોર, ડભોઇ તાલુકાના બારગામ પાટીદાર સમાજના સતપંથી ભકતો પરંપરાગત અમૃત મહોત્સવનો લહવો લેવા પગપાળા યાત્રા સંઘ સાથે વહેલી સવારે નીકળી ગયા છે. ગ્રામજનો દ્વારા તેઓને ભાવભીની વિદાય આપી હતી.

શિનોરના અવાખલ, માંજરોલ, કુકસ, ભેખડા-સાંધા, પુનિયાદ, માલપુર સહિત ડભોઇ તાલુકાના પિસાઇ ગામના સતપંથી ભાઇ-બહેનો તા.૩૧મી માર્ચના ગ્રામજનોની વિદાય સાથે દર વર્ષની જેમ શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા મુકામે યોજાયેલાઅમૃત મહોત્સવનો લહાવો લેવા પગપાળા નીકળ્યા છે. જેઓ તા.૫મી એપ્રીલના પીરાણા પહોંચશે. જયાં આ તમામ પદયાત્રીઓનું ભવ્ય સામૈયું કરાશે.

પીરાણા મુકામે સવારના ૪ વાગે વારીયક્ષ ૭ વાગે સંઘોનું સામૈયુ, ૯ થી ૧૧:૩૦ સત્સંગ તથા જગદ્ગુરુ સત પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ અને અન્ય સંતો-મહંતો આશીર્વાદ આપી ધર્મસભા સંબોધશે. આ પ્રસંગે ગુજરાત, સુરત, અમદાવાદ, કચ્છ, કાનમ પ્રદેશ સહિત મહારાષ્ટ્રથી ૧ લાખ ઉપરાંત સત્યથી ભાઇ-બહેનો પગપાળા આવે છે. તા.૫મી એપ્રીલના આ વિશાળ સંઘો માટે બ્રહ્મભોજનના દાતા તરીકે શિનોર તાલુકાના કુકસના સ્વ. નાથાભાઇ ગુલાબભાઇ પટેલનું પરિવાર તથા જામરંલા કથા, ગુજરવા કંપાના ડાહ્યાભાઇ પટેલ, રમણભાઇ પટેલ તથા જયંતીભાઇ પટેલ છે. કાનમ પ્રદેશના અવાખલના ટ્રસ્ટી સુરેશભાઇ એમ. પટેલે શ્રધ્ધાળુઓને લાભ લેવા અપીલ કરાઇ છે.

Previous Story
મોટી આદરજમાં પીવાના પાણીની પાઈપલાઈન બદલાશે

Next Story
મહાનગર પાલિકાની ચૂંટણીમાં પોલીસનું એનઓસી લેવા ભીડ

realpatidar.com